

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૦/૦૩/૨૦૧૮ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૭૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૧ કેસ કરી, ૪૭ વ્યક્તિઓને ઝડપી, ૬૮૫ લીટર દેશી દારૂ, ૨૮૮ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૧ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૪૩૨ બિયર ટીન, ૧ મોટર સાયકલ અને ૧ બોલેરો પીક અપ કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૨૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૩,૬૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૮૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૧૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૪૮૧/૧૮

સરદારનગર: દિનેશભાઈ નારાયણભાઈ પરમાર (રહે. શાંતીનગરના છાપરાં સુભાષનગર પાસે નોબલનગર સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૩/૧૮ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે પોતાના મકાનના દરવાજાનુ તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૪૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૨૩,૩૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એન.એન.ચાવડા ચલાવે છે.

સરદારનગર: મુગ્દાજસિંહ કિશોરસિંહ જાડેજા (રહે.ઓરચીડ પેરેડાઇઝ સફલ પરીસરની સામે સાઉથ બોપલ) એ તા.૦૯/૦૩/૧૮ નારોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૩/૧૮ કલાક ૧૨/૦૦ થી તા.૦૩/૦૩/૧૮ સુધીના સમયગાળા દરમ્યાન સરદારનગર તુલસીબાગ સીંધી કોલોની ખ્યાતિ સ્કૂલમાંથીસેમસંગ કંપનીનુ એલ.ઈ.ડી., ગેસનો બાટલો અને પંખા મળી કુલ કિંમત રૂપિયા ૧૯,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડો.એમ.એમ.ઠાકોર ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૪૮૨/૧૮

નારણપુરા: આશાબહેન કંદર્પભાઈ વૈદ્ય (ઉ.વ.૬૯) (રહે. વ્રજ ભુમી ફ્લેટ ઝોધપુરા ગામ સેટેલાઈટ તા.૦૯/૦૩/૧૮ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે નારણપુરા એસીયન કોલોની સામે વરદાન ટાવર પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષો આશાબહેનના ગળામાંથી સોનાની બોરમાળા કિંમત રૂપિયા ૮૦,૦૦૦/-અને સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ આશાબહેને નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.કે.રાહોડ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૪૮૩/૧૮

નરોડા: મહેશભાઈ સેધાજી ઠાકોર (રહે.સરપંચવાસ મુઠીયાગામ નરોડા) એ અગમ્ય કારણસર તા.૦૭/૦૩/૧૮ કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તા.૦૯/૦૩/૧૮ સાંજના ૫/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતુઆ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમેશભાઈ અમૃતભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર: અર્જુનદાસ કેવલરામ વનજાણી રહે ૫૯/૪ દેવજી ની ગલી ઠક્કરનગર) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૩/૧૮ કલાક ૮/૪૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિજયભાઈ માણિરાવ ચલાવે છે.

ખોખરા: વનીતાબહેન વા/ઓ સંડેરભાઈ કનોજીઆ (ઉ.વ.૨૬) (રહે. બળદેવભાઈની ચાલી રાધા કિશનનગર ભાઈપુરા ખોખરા) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૩/૧૮ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી આર.પી.મકવાણા ચલાવે છે.

કાગડાપીઠ: દિનેશભાઈ હરીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫) (રહે. મહાલક્ષ્મી એવન્યુ ભુલાભાઈ પાર્ક) એ બિમારીથી કંટાળી તા.૦૯/૦૩/૧૮ કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી બાલાજી હિરાજી ચલાવે છે.

નારોલ: જગદિશપ્રસાદ મંગલા ચૌધરી (મુઢ) (ઉ.વ.૩૪) (રહે. વસંતવિહાર સોસાયટી નારોલ કોર્ટની સામે નારોલ) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૩/૧૮ કલાક ૧૧/૩૦ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખાના હુકમાં નાઇલોનની દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મોહનસિંહ સવસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.